

# કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ ખાતે ૧૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ ની બેઠક યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતે તા. ૧૬/૧/૨૦૧૮ ના રોજ માનનીય કુલપતિશ્રી, આકૃયુ, આણંદ ના અધ્યક્ષ સ્થાને ૧૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ ની બેઠક યોજાઈ. આ બેઠક માં આમંત્રિત સભ્યશ્રી આકૃયુ ના સંશોધન નિયામકશ્રી તથા વિદ્યાશાખાના અધ્યક્ષ ડૉ. કે. બી. કથીરીયા અને વિસ્તરણ નિયામકશ્રી ડૉ. અરૂણ એ. પટેલ સભ્ય તરીકે હાજર રહ્યા હતા. ઉપરોક્ત કમિટીમાં સામેલ અમદાવાદ જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી. બી. વી. વસોયા, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી. વી. એમ. બથાર, સિનિયર સાયન્ટીસ્ટ, ક્ષેત્રિય સંશોધન કેન્દ્ર, આઈ. સી. એ. આર., સીકા, આણંદ ડૉ. સી. કે. મિશ્રા, પ્રાધ્યાપક અને વડાશ્રી, એગ્રોનોમી વિભાગ, આકૃયુ, આણંદ ના પ્રતિનિધિ તરીકે ડૉ. સંજય શાહ, પ્રાધ્યાપક અને વડાશ્રી, પેથોલોજી વિભાગ, વેટેરીનરી કોલેજ, આણંદ ના પ્રતિનિધિ ડૉ. સી. જે. દવે, પ્રગતિશીલ ખેડૂત શ્રીમતિ શેરબાનુ મોમીન (સાથળ) અને શ્રી. મનોજભાઈ એમ પટેલ (સીમેજ), તથા કેવિકે તથા સંશોધન કેન્દ્ર અરણેજ ના વૈજ્ઞાનિકશ્રીઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ કરેલ વર્ષ ૨૦૧૭-૧૮ દમ્યાન કરેલ પ્રવૃત્તિઓની ઝાંખી ડૉ. જે. કે. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી એ રજૂ કરી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના દરેક વૈજ્ઞાનિકે તેમના વર્ષ દરમ્યાન કરેલ કાર્યોની ઝાંખી સમિતિ સમક્ષ રજૂ કરી.

માનનીય કુલપતિશ્રી એ ભૌગોલિક પરિસ્થિતીને અનૂરૂપ નવા પાકો જેમાંથી ખેડૂતોની આવક બમણી થાય તેના પર ચિંતન કરી કામ કરવા કૃષિ વૈજ્ઞાનિકોને હાકલ કરી અને તેના પર ભાર આપવા જણાવ્યું. ડૉ. કે. બી. કથીરીયા, સંશોધન નિયામકશ્રી તથા વિદ્યાશાખાના અધ્યક્ષ એ સંશોધન કેન્દ્ર અને કેવિકે વચ્ચેના તાલમેલ ને બીરદાવ્યો અને આ વિસ્તાર ના ખેડૂતો માટે સંયુક્ત રીતે કામ કરવા જણાવ્યું. ડૉ. અરૂણ એ. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી એ કેવિકે ની નવી પરિસ્થિતિમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને વિસ્તરણ ને બજારલક્ષી બનાવવા માટેના પ્રયત્નો કરવાની વૈજ્ઞાનિકોને સલાહ આપી. અંતમાં માનનીય કુલપતિશ્રી અને હાજર રહેલા સર્વે સભ્યોએ કેવિકે ફાર્મ તથા સંશોધન કેન્દ્રના ફાર્મની મુલાકાત લીધી.

ડૉ. જી. એચ પટેલ, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન) એ આભારવિધિ કરી માનનીય કુલપતિશ્રીની સંમતિથી કાર્યક્રમ પૂર્ણ કર્યો.

કાર્યક્રમની ઝાંખીઓ :





